



રાજકોટ મહાનગરપાલિકા

જાહેર આમંત્રિત નિવિદા

કામનું નામ: વોર્ડ નં.૧૭ માં આનંદનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ઈ૩ બ્લોકના (પહેલા માળના ક્વાર્ટર નં.૫૭ થી ૬૪ [૬૨ સિવાય] અને બીજા માળના ક્વાર્ટર નં.૬૫ થી ૭૨) કુલ ૧૫ ક્વાર્ટસનો ઉભો ઈમલો તોડી પાડવાનું કામ

ટેન્ડર મેળવવાની તારીખ	:	૦૭/૦૮/૨૦૨૦ સવારનાં ૧૧:૦૦ વાગ્યાથી ૧૯/૦૮/૨૦૨૦ બપોરનાં ૧:૦૦ વાગ્યા સુધી
ટેન્ડર રજુ કરવાની તારીખ	:	૨૧/૦૮/૨૦૨૦ સાંજનાં ૬:૦૦ વાગ્યા સુધી (માત્ર રજીસ્ટર પોસ્ટ કે સ્પીડ પોસ્ટ દ્વારા)
ટેન્ડર ખોલવાની તારીખ	:	૨૪/૦૮/૨૦૨૦ બપોરનાં ૫:૦૦ કલાકે (શક્ય હશે તો)
ટેન્ડર ફી	:	૧૧૨૫-૦૦ (અંકે રૂપીયા એક હજાર એક્સો પચ્ચિસ પુર)
અર્નેસ્ટ મની ડિપોઝીટ	:	૫૦,૦૦૦/- (અંકે રૂપીયા પચાસ હજાર પુર)
ટેન્ડર વેલીડીટી	:	૬૦ દિવસ

એડી.સિટી એન્જીનીયર
મધ્ય ઝોન
રાજકોટ મહાનગરપાલિકા



રાજકોટ મહાનગરપાલિકા

હૈયાત બિલ્ડીંગ તોડી પાડવા માટેની જાહેર આમંત્રિત નિવિદા

જરૂરી સુચનો (ટેન્ડર ભરનાર માટે)

ટેન્ડર સીલબંધ કવરમાં રજુ કરવાનું રહેશે તેમજસીલબંધ કવરની ઉપર કામનું નામ "વોર્ડ નં.૧૭ માં આનંદનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ઈંડ બ્લોકના (પહેલા માળના ક્વાર્ટર નં.૫૭ થી ૬૪ [૬૨ સિવાય] અને બીજા માળના ક્વાર્ટર નં.૬૫ થી ૭૨) કુલ ૧૫ ક્વાર્ટસનો ભયગ્રસ્ત ભાગ દૂર કરવાનું કામ" સ્પષ્ટ અક્ષરમાં લખવાનું રહેશે

૧. ટેન્ડર સીલબંધ કવરમાં એડી.સિટી એન્જીનીયર, ડો.આંબેડકર ભવન, બાંધકામ શાખા, મધ્ય ઝોન, ઢેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧ નાં સરનામે ટેન્ડર રજુ કરવાની આખર તારીખ સુધીમાં પહોચાડવાનું રહેશે.
૨. સ્થળ વિઝીટ માટે જાહેર રજાનાં દિવસો સિવાયનાં દિવસોએ સમય સવારનાં ૧૦:૦૦ થી સાંજનાં ૬:૦૦ સુધીમાં સંલગ્ન અધિકારીશ્રીનો સંપર્ક કરવો
૩. ટેન્ડર રજુ કરનાર એજન્સીએ ટેન્ડરનાં દરેક પાનાં પર સહી તથા સિક્કા કરેલ હોવા જોઈએ જો ભાગીદારી પેઢી હોય તો દરેક પાર્ટનરની સહી હોવી જોઈએ અથવા સહી કરનાર વ્યક્તિનાં નામે પાવર ઓફ એટર્ની હોવી જોઈએ તેમજ એજન્સી ઈન્ડિયન પાર્ટનરશીપ એક્ટ હેઠળ નોંધવામાં આવેલ હોવી જોઈએ. ટેન્ડર સાથે સદરહુ દરેક પુરાવા રજુ કરવાનાં રહેશે
૪. ટેન્ડર ભરનાર એજન્સીએ આ સાથે સામેલ ફોર્મ માંજ વિગતો તેમજ ભાવ રજુ કરવાનાં રહેશે સામેલ ફોર્મ સિવાય રજુ કરેલ વિગત કે ભાવ માન્ય રાખવામાં આવશે નહી
૫. ટેન્ડરમાં દર્શાવેલ તારીખ અને સમય સુધીમાં પહોચતુ કરવાનું રહેશે તેમજ ટેન્ડર ખોલવાના સમયે હાજર રહેલ એજન્સી સમક્ષ ટેન્ડર ખોલવામાં આવશે.
૬. ટેન્ડર સાથે અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઈ.એમ.ડી.) ૫૦,૦૦૦/- "રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન" નાં નામનો નેશનલાઇઝ્ડ બેંક / શેડ્યુલ્ડ બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજુ કરવાનો રહેશે. (યુકવવાપાત્ર : રાજકોટ)

૭. ટેન્ડરની અવધિ ૬૦ દિવસની રહેશે. આ સમય દરમિયાન જો એજન્સી દ્વારા જો ટેન્ડર પરત લેવા કે નિયમોમાં ફેરફાર કરવા માંગણી કરવામાં આવશે તો તે માન્ય રાખવામાં આવશે નહીં તેમજ જો એજન્સી દ્વારા ટેન્ડર સ્વિકાર કર્યા બાદ બીડની રકમ ભરવામાં નહીં આવેતો કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એજન્સીને ગેરલાયક ઠરાવવામાં આવશે તેમજ તેઓ દ્વારા રજુ કરવામાં આવેલ અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઈ.એમ.ડી.) ની રકમ જપ્ત કરવામાં આવશે.
૮. રાજકોટ મહાનગરપાલિકાનાં કોઈપણ અધિકારી/કર્મચારી સાથે એજન્સી સંકળાયેલ હોવી જોઈએ નહીં. જો એજન્સી રાજકોટ મહાનગરપાલિકાનાં કોઈપણ અધિકારી/કર્મચારી સાથે સંકળાયેલ માલુમ પડશે તો એજન્સીને ગેરલાયક ઠરાવવામાં આવશે.
૯. રજુ કરવામાં આવેલ ટેન્ડર પૈકી કોઈપણ ટેન્ડર કારણ દર્શાવ્યા વિના સ્વિકાર કરવા કે નાં સ્વિકારવાં બાબત આખરી નિર્ણય કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા નો રહેશે. તેમજ ટેન્ડર રજુ કરનાર એજન્સી નિયત શરતો પરિપૂર્ણ નહીં કરતી હોય તો તેઓનાં રજુ કરેલ ટેન્ડરને રદપાત્ર ગણવામાં આવશે.
૧૦. ટેન્ડરની નકલ રાજકોટ મહાનગરપાલિકામાં નિયત ટેન્ડર ફી ભરી એડી.સિટી એન્જીનીયર, ડો.આંબેડકર ભવન, બાંધકામ ક્ષેત્ર, મધ્ય ઝોન, ઢેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧ ખાતેથી મેળવવાની રહેશે. અથવા રાજકોટ મહાનગરપાલિકાની વેબ સાઇટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે જે માટે ટેન્ડર ફી ભર્યાની પહોંચ ટેન્ડર સાથે રજુ કરવાની રહેશે.
૧૧. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઇમ્લો તોડવાનો અનુભવ ધરાવતા હેલા જોઈએ તે અંગેનો અનુભવનો દાખલો રજુ કરવાનો રહેશે.
૧૨. The word "Arbitration" or "Arbitration Clause" wherever mentioned in this tender document, is now to be treated as "Deleted". In this context, an Order bearing No.RMC/Legal/1858 dated 18-02-2017 of Legal Department of Rajkot Municipal Corporation is uploaded separately along with this tender, which Order, will hereafter be referred and taken into consideration for Arbitration related purpose for the tenders of Rajkot Municipal Corporation.
૧૩. વર્ક ઓર્ડર મળે તુરત જ કામ ચાલુ કરવાનું છે ઓર્ડરમાં જણાવેલ ૬૦ દિવસની મુદત દરમિયાન કામગીરી કરવાની છે. જો મુદત દરમિયાન સુચના પ્રમાણે કામ કરવામાં નહીં આવે તો શ્રી કમિશ્નર સાહેબને યોગ્ય લાગશે તો કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે અન્ય કોન્ટ્રાક્ટર પાસે અગર તો ખાતા મારફત કામ પુરૂ કરાવશે. અને આમ બાકી રહેતુ કામ પુરૂ કરવામાં મહાનગરપાલિકાને કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કરતા જો વધુ ખર્ચ થશે તો તે કોન્ટ્રાક્ટર પાસેથી

કાયદેસર રીતે આ વધારાનો ખર્ચ વસુલ કરી શકશે તથા તેની સીક્યોરીટી જપ્ત કરી શકશે. શ્રી કમિશ્નર સાહેબને જો યોગ્ય લાગશે તો મુદત દરમ્યાન કામ પુરૂ નહિં થયું હોય છતા પણ કોન્ટ્રાક્ટર પાસે કામ ચાલુ રખાવી શકશે અને તેની મુદત સંજોગોનેલક્ષમાં રાખીને જરૂર જણાયે વધારી આપશે અગરતો દરરોજના 0.20% લેખે દંડ કરી શકશે.

૧૪. એજન્સી દ્વારા રજુ કરવામાં આવેલ ભાવ અત્રેથી સ્વીકાર્યા બાદ સદરહુ કામે નિયમાનુસાર ભરવાની થતી સીક્યુરીટી ડીપોઝીટ તેમજ કરાર કરવા જણાવવામાં આવ્યેથી નિયત સમય મર્યાદામાં સીક્યુરીટી ડીપોઝીટ ભરી તેમજ સ્ટેમ્પ ડ્યુટી એક્ટ ૧૯૫૮ અને તેના રીવીઝન મુજબ કરારનામું કરવાનું રહેશે જેમાં નિષ્ફળ ગયેથી ભરવામાં આવેલ અર્નેસ્ટ મની ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે અને એજન્સીને રાજકોટ મહાનગરપાલિકાના કામો માટે ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ / ડીબાર કરવામાં આવશે.
- ૧૫ કોઈ પણ કારણોસર કોન્ટ્રાક્ટર ટેન્ડરમાં દર્શાવેલ કામ કરવા અશક્તિમાન થશે કે કામ અધુરૂ છોડી દેશે અથવા કામ બંધ કરી દેશે તો તેવા સંજોગોમાં ઈએમ.ડી. / સીક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે અને રાજકોટ મહાનગરપાલિકા એજન્સીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ / ડીબાર કરવામાં આવશે અને એજન્સીના ખર્ચે અને જોખમે આ કામ પુરૂ કરાવશે. અને આમ કરતાં ટેન્ડરમાં જણાવેલ ભાવ કરતાં વધારે ખર્ચ થશે તો મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરની સીક્યોરીટી ડીપોઝીટમાંથી કે સાઈટ ઉપર પડેલા માલ સામાનની હરરાજી કરી ખર્ચ વસુલ કરી શકશે અને તેમ કરતાં કોન્ટ્રાક્ટરનો કોઈપણ વાંધો કે હકક રહેશે નહિં
૧૬. રાજકોટ મહાનગરપાલિકા ચાલુ કોન્ટ્રાક્ટ દરમ્યાન કોઈ પણ કારણ દર્શાવ્યા વગર કે નોટિસ આપ્યા વગર કોન્ટ્રાક્ટ રદ કરવાનો હકક અબાધિત રાખે છે.
૧૭. ચાલુ કામ દરમ્યાન કોઈ વિવાદ ઉપસ્થિત થયે, આ સાથે સામેલ રાખવામાં આવેલ હુકમ નં.રામનપા/લીગલ/૧૮૫૮ તારીખ ૧૮-૦૨-૨૦૧૭ ધ્યાને લઈ નિર્ણય કરવામાં આવશે જે આખરી રહેશે અને એજન્સીને બંધનકર્તા રહેશે
૧૮. એજન્સી દ્વારા કામ દરમ્યાન ઈ-ટેન્ડરની કોઈ પણ શરતોનું ભંગ કરવામાં આવશે તો સીક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કામોમાંથી ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ / ડીબાર / ટર્મિનેટ કરવામાં આવશે.
૧૯. આ કામે એજન્સીએ પુખ્ત વયના અને અનુભવી માણસો તેમજ અનુભવી સુપરવાઈઝરી સ્ટાફ રાખવાનો રહેશે.
૨૦. કામ કરતા મજૂરોની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે તથા પુરતા સુરક્ષા સાધનો વસાવવાના રહેશે અને મજૂરોને જરૂરી વિમા કવચથી સુરક્ષા અપાવવાની રહેશે. કામ

દરમ્યાન કામદારને કોઈ પણ પ્રકારે ઈજા થાય તો રાજકોટ મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારનું ચુકવણુ કરવા જવાબદાર નથી એજન્સીએ પોતાના મજુરો / વર્ક ફોર્સની સંપૂર્ણ સુરક્ષા માટે વિમા કવચ પુરૂ પાડવાનું રહેશે અને તે અંગે કરેલ વ્યવસ્થા સંબંધક દસ્તાવેજોની નકલ રાજકોટ મહાનગરપાલિકાને રજૂ કરવાની રહેશે.

૨૧. કામગીરી દરમ્યાન અકસ્માતો, ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં ખર્ચ / વળતરની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે તથા કાયદાકિય કાર્યવાહી માટે કોન્ટ્રાક્ટર જ જવાબદાર રહેશે.
૨૨. રસ્તા ઉપરની કામગીરી માટે રસ્તા બંધ ના બોર્ડ તથા જરૂરી સીક્યુરીટીની વ્યવસ્થા એજન્સીએ કરવાની રહેશે.
૨૩. ઈ-ટેન્ડર શરતમાં કોઈ પણ શરતનો ભંગ થયે કોન્ટ્રાક્ટ રદ કરી સીક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે.
૨૪. કામગીરી દરમ્યાન અકસ્માત, ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં ખર્ચ / વળતરની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે. તથા કોન્ટ્રાક્ટર તમામ કાયદાકિય કાર્યવાહી માટે જવાબદાર રહેશે. ફોજદારી ગુનો બનતો હોય તો તે માટે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે.
૨૫. કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા મજુરોનું નિયમિતભાવે મેડીકલ ચેકઅપ કોન્ટ્રાક્ટરશ્રીના ખર્ચે કરાવવાનું રહેશે.
૨૬. કોન્ટ્રાક્ટરશ્રીએ વર્કમેન કોમ્પેન્સેશન એક્ટ હેઠળ ડબલ્યુ.સી. પોલીસી લેવાની રહેશે. તથા ૧૦ કામદારો થી વધુ હોય તો લેબર લાયસન્સ લેવાનું રહેશે ૧૦ થી ઓછા માટે બાહેધરી પત્રક રજૂ કરવાનું રહેશે પરંતુ પ્રવર્તમાન ધોરણે વર્કમેન કોમ્પેન્સેશન એક્ટ હેઠળ ડબલ્યુ.સી. માટેની જરૂરી વિધીનું પાલન કરવાનું રહેશે.
૨૭. કોન્ટ્રાક્ટરશ્રીએ સરકારશ્રીના પ્રવર્તમાન પી.એફ.નિયમ મુજબ પોતાના હસ્તકના કામદારો માટે કર્મચારી પ્રોવીડન્ટ ફંડ નંબર (ઈ.પી.એફ.) લેવાનો રહેશે.
૨૮. જરૂર જણાયે કોન્ટ્રાક્ટરશ્રીએ સર્વિસ ટેકસના કાયદા મુજબ નંબર લેવાના રહેશે.
૨૯. કોન્ટ્રાક્ટરશ્રીએ હાલના ચાલુ કે નવા લાગુ પડનાર તમામ પ્રકારના ટેકસ સાથે ગણતરી કરી ભાવો ભરવાના રહે છે. રાજકોટ મહાનગરપાલિકા આ માટે વધારાનું કોઈ ચુકવણું કરશે નહીં સરકારી નિયમ મુજબ ઈન્કમ ટેકસ તથા લેબર સેસ કે અન્ય ટેકસ કોન્ટ્રાક્ટરના બીલમાંથી કપાત કરવામાં આવશે તથા કોન્ટ્રાક્ટ દરમ્યાન સરકારશ્રી તરફથી કોઈ નવા કર કે કરના દરમાં ફેરફાર કરવામાં આવશે તો તે અંગેની જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે.

૩૦. કોન્ટ્રાક્ટરે ૧૮ વર્ષથી ઓછી ઉમરના કોઈને કામે રાખવાના નથી.
૩૧. આ કોન્ટ્રાક્ટ અંગે ન્યાયતંત્ર રાજકોટ શહેર રહેશે તેમજ ઈ-ટેન્ડર ફી, અર્નેસ્ટ મની ડીપોઝીટ અને સીક્યોરીટી ડીપોઝીટ તરીકે રજૂ કરવાના થતા ડીમાન્ડ ડ્રાફ્ટ, ફીક્સ ડીપોઝીટ (એફ.ડી.આર.) રાજકોટ શહેર લોકલ બ્રાન્ચ અને પેએબલ એટ રાજકોટ શહેરના જ હોવા જોઈશે.

એડી.સિટી એન્જીનીયર
બાંધકામ શાખા
રાજકોટ મહાનગરપાલિકા

DEMOLITION OF BUILDING

The undersigned (hereinafter called PURCHASER) hereby tender(s) to the Rajkot Municipal Corporation, through the Addl. City Engineer, Construction Branch, Rajkot Municipal Corporation, Dr. Ambedkar Bhavan, Central Zone, Dhebar Road, Rajkot-360001, the sum of Rs. (Rupees) for the purchase of the partial building described in the first schedule hereto on the terms and subject to the conditions set out in the 2nd schedule hereto. A sum of Rs. as earnest money is sent herewith and shall be forfeitable to Municipal Corporation if the tender be withdrawn within 60 days of being received by the Commissioner or if accepted the tenderer fails to complete the contract. This is to be without prejudice to any other remedy of Municipality on account of any default.

Signature of Tenderer(s):

Address of Tenderer(s):

Dated:

Signature of witness:

Address of witness:

The undersigned hereby accepts the above tender on behalf of the Rajkot Municipal Corporation.

Signature:

Dated:

Witness:

THE FIRST SCHEDULE
(Description of the Buildings)

All, these buildings comprised in the property known as at and bounded as follows:

North	:	}	As per drawing enclosed
East	:		
South	:		
West	:		

CONTRACTOR

Addl.City Engineer
Rajkot Municipal Corporation

THE SECOND SCHEDULE (Condition of sale)

૧. કામ રાખનાર એજન્સીએ જરૂરી કરાર કરવાનો રહેશે તેમજ કરાર કર્યાની તારીખથી દિવસ ૫ (પાંચ)માં ટેન્ડર મુજબ નક્કી કરવામાં આવેલ રકમ રાજકોટ મહાનગરપાલિકામાં ૧૦૦% ભરી આપવાની રહેશે. એજન્સી દ્વારા ૧૦૦% રકમ ભરી રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પહોંચ મેળવી ત્યારબાદ જ કામગીરી શરૂ કરવાની રહેશે. અને કામગીરી શરૂ કર્યાની જાણ રાજકોટ મહાનગરપાલિકાનાં આ કામનાં ઈન્યાર્જ એન્જીનીયરશ્રીને કરવાની રહેશે.
૨. એજન્સીએ બિલ્ડીંગને લગત તમામ વિગત રાજકોટ મહાનગરપાલિકાનાં સંલગ્ન વિભાગ પાસેથી મેળવવાની રહેશે. કામ રાખનાર એજન્સી પાસે બિલ્ડીંગને લગત તમામ જાણકારી હોવી જોઈએ. બાદમાં કોઈપણ પ્રકારની રજુઆત સાંભળવામાં આવશે નહીં.
૩. કામ રાખનાર એજન્સીએ બિલ્ડીંગનાં ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરનાં કુલ ૧૫ ક્વાટર્સનું તોડકામ કરી આપવાનું રહેશે તેમજ સાઈટ ચોખ્ખી કરી આપવાની રહેશે તોડકામ માટે જરૂરી તમામ સાધનોની વ્યવસ્થા એજન્સીએ કરવાની રહેશે. બિલ્ડીંગનું તોડકામ ૬૦ (સાઈઠ) દિવસમાં પૂર્ણ કરવાનું રહેશે.
૪. જો તોડકામની કામગીરી દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર ડેમેજ થશે તો સુચન પ્રમાણે ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ગ્રાઉન્ડ લેવલ સુધી સંપૂર્ણ પણે તોડકામકરી પૂરી જમીનનું લેવલીંગ કરી આપવાનું રહેશે બાંધકામ માટે વધારાની સમય મર્યાદા આપવામાં આવશે નહીં ઉપરોક્ત ૬૦ દિવસનાં સમયગાળામાં કરવાનું રહેશે ગ્રાઉન્ડ ફ્લોરના તોડકામ માટે ૩૫% વધુ રેટ અપાશે / લેવામાં આવશે.
૫. સદરહું તોડકામની કામગીરી મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત કરેલ સ્ટ્રક્ચરલ એન્જીનીયરની સલાહ મુજબ કરવાનું રહેશે.
૬. એજન્સીએ ટેન્ડર ફી નો ડીમાન્ડ ડ્રાફ્ટ, ઈ.એમ.ડી. નો ડીમાન્ડ ડ્રાફ્ટ તેમજ અન્ય રજુ કરવાના થતા જરૂરી ડોક્યુમેન્ટસ સાથે ઈ.એસ.આઈ.સી. રજીસ્ટ્રેશનની નકલ તેમજ ઈ.પી.એફ. રજીસ્ટ્રેશનની નકલ અત્રેની કચેરીને રજુ કરવાના રહેશે અન્યથા એજન્સીને નોન-રીસ્પોન્સીવ ગણી તેવી એજન્સીના ભાવ ખોલવામાં આવશે નહીં.
૭. ગુજરાત સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગના જી.આર. નં.સી.ડબલ્યુ.એ/૨૦૦૪/૮૪૧/એમ-૩ તા.૩૦.૦૧.૦૬ ના ઠરાવ મુજબ શ્રમીકોના કલ્યાણ માટે બીલની કુલ રકમના ૧% (એક ટકા) લેખે સેસ રકમ રાજકોટ મહાનગરપાલિકા રનીંગ બીલમાંથી કપાત કરશે, તેમજ તેના માટે જરૂરી રજીસ્ટ્રેશન એજન્સીએ સ્વ.ખર્ચે કરવાનું રહેશે.

એડી.સિટી એન્જીનીયર

મધ્ય ઝોન

રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા

ઈમલો પાડવાના કામ અંગે

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૭ માં આનંદનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ઈ૩ બ્લોકના (પહેલા માળના ક્વાર્ટર નં.૫૭ થી ૬૪ [૬૨ સિવાય] અને બીજા માળના ક્વાર્ટર નં.૬૫ થી ૭૨) કુલ ૧૫ ક્વાર્ટસનો ઉભો ઈમલો પાડી લઈ જવાના કામ માટેના ભાવો, પોતાના લેટર પેડ ઉપર સીલ-બંધ કવરમાં ટેન્ડરમાં દર્શાવેલ તારીખ સુધીમાં માત્ર રજીસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટથી એડી.સિટી એન્જીનીયર, ડો.આંબેડકર ભવન, બાંધકામ શાખા, મધ્ય ઝોન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ બાંધકામ શાખા કચેરીમાં મળી જાય તે રીતે રસ ધરાવતા આસામીશ્રીઓ પાસેથી માંગવામાં આવે છે.

૧. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૭ માં આનંદનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ઈ૩ બ્લોકનો ઉભો ઈમલો પાડી તેમાંથી નીકળતો તમામ માલ-સામાન લઈ જવાનો રહેશે અને જમીન લેવલ સુધી સાઈટ સાફ કરી આપવાની રહેશે ઈમલામાંથી નીકળતો તમામ માલ-સામાન લઈ જઈને તેની સામે કેટલી રકમ મહાનગરપાલિકાને આપવાની છે તે દર્શાવવાની રહેશે.
૨. આ ડીમોલીશન દરમ્યાન બિલ્ડીંગને નુકશાન ન થાય તે રીતે કરવાનું રહેશે તેમજ કોઈ પણ જાન-માલની નુકશાની ન થાય તે રીતે કરવાનું રહેશે આ અંગેની સંપૂર્ણ જવાબદારી તેમજ વળતર ચુકવવાનું થાય તો તે કામ રાખનારની રહેશે કોઈ પણ વ્યક્તિનાં ઈજા / જાનમાલનાં નુકશાન અંગેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે.
૩. આ કામ વર્ક ઓર્ડર આપ્યાથી દિવસ-૬૦ માં પૂર્ણ કરવાનું રહેશે.
૪. આ કામે ભાવના બંધ કવર સાથે અર્નેસ્ટ મની ડીપોઝીટ તરીકે રૂ.૫૦,૦૦૦/- (અંકે રૂપિયા પચાસ હજાર પુરા) નો "રાજકોટ મહાનગરપાલિકા" ની તરફેણનો ડીમાન્ડ ડ્રાફ્ટ સામેલ કરવાનો રહેશે અને કવર પર "વોર્ડ નં.૧૭ માં આનંદનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ઈ૩ બ્લોકનો ઉભો ઈમલો પાડી લઈ જવાના કામ માટેના ભાવો" તેમ દર્શાવવાનું રહેશે.
૫. ભાવ મંજૂર થયે ઈમલાની ૧૦૦% રકમ ભરપાઈ કરી ધોરણસરનું કરારનામુ રાજકોટ મહાનગરપાલિકાની તરફેણમાં કરી આપવાનું રહેશે.
૬. આવેલ સૌથી ઉંચી ઓફર કે કોઈ પણ ઓફર મંજૂર / નામંજૂર કરવાનો રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ, ના અધિકારો અબાધિત રાખવામાં આવે છે. તેમજ કોઈ પણ વિવાદીત તથા કાયદાકિય બાબતો અંગે મ્યુનિસિપલ કમિશ્નરશ્રીનો નિર્ણય આખરી તથા બંધનકર્તા રહેશે.
૭. આ કામે વિશેષ માહિતીની જરૂર જણાય તો સંબંધિત કામના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, બાંધકામ શાખાનો સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમ્યાન ડો.આંબેડકર ભવન, બાંધકામ શાખા, મધ્ય ઝોન, ઢેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧ કચેરીમાં કામના દિવસો દરમ્યાન સંપર્ક કરવો. સંપર્ક કરવો. (મોબાઈલ નં. ૯૬૨૪૭૧૭૮૦૦ છે.)
૮. ઈમલો ઉતારવાની પ્રક્રિયા દરમ્યાન પ્રક્રિયા શરૂ થયા બાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનાં જાનબ્માલની નુકશાની ન થાય તે માટે લગત જરૂરી વિસ્તારની પતરા દ્વારા ઘેરાબંધી કરી જરૂરી જગ્યાએ સદર ન પ્રવેશવાની સુચનાના બોર્ડ મુકવા સુધીની જવાબદારી એજન્સીની રહેશે.

એડી.સિટી એન્જીનીયર
મધ્ય ઝોન
રાજકોટ મહાનગરપાલિકા